https://archive.org/details/bk1095/page/n0/mode/1up

1989 Around -SandhyaPath (1095)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

સંધ્યાપાઠ



સંગ્રાહક :
મહારાજ શ્રી કરશનદાસજી
ગુરુ શ્રી શાંતિરામજી

ઈશ્વરનગર, ઈશ્વર આશ્રમ, વાંઢાય, પો. દેશલપર
તા. ભુજ-કચ્છ - ૩૭૦ ૦૪૦ ✆ : ૩૦ (દેશલપર એક્ષ્ચેન્જ)

realpatidar.com

Published around the year 1989

https://archive.org/details/bk1095/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 11.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1095/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 17:42:41 +05'30'

realpatidar.com

સંધ્યાપાઠ



સંગ્રાહક :
મહારાજ શ્રી કરશનદાસજી
ગુરુ શ્રી શાંતિરામજી
ઈશ્વરનગર, ઈશ્વર આશ્રમ, વાંઢાય, પો. દેશલપર
તા. ભુજ-કચ્છ - ૩૭૦ ૦૪૦ ✆ : ૩૦ (દેશલપર એક્ષ્ચેન્જ)

realpatidar.com

Published around the year 1989

https://archive.org/details/bk1095/page/n3/mode/1up

realpatidar.com

શ્રી ગુરુ સતનામ

મા-બાપને કદી ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
પત્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું.
એ પુનીત જનના કાળજાં, પત્થર બની છુંદશો નહિ.
કાઢી મુખેથી કોળીયા, મ્હોમાં દઈ મોટા કર્યા.
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા.
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.
લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યા.
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો.
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને.
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ.
પુષ્પો બીછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર.
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ.
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ.
પલ પલ પુનીત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n4/mode/1up

realpatidar.com



સંત શ્રી ઈશ્વરરામજી ગુરુ શ્રી ક્ષેમસાગરજી

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n5/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n6/mode/1up

realpatidar.com



પૂ. સંત શ્રી ઓધવરામજી ગુરુ શ્રી લાલરામજી

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n8/mode/1up

realpatidar.com



પૂ. મહંત શ્રી કરશનદાસજી ગુરુ શ્રી શાંતિરામજી

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n9/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n10/mode/1up

realpatidar.com

ઉમિયા મંદિર - વાંઢાય

સંવત ૧૯૮૭ ના કારતક સુદ - ૧ ના રોજ બ્રહ્મનિષ્ઠ મહારાજશ્રી ઓધવરામજીએ તેમને વિધિસરની દિક્ષા આપી **દયાળદાસજી** એવું નામાભિધાન આપ્યું મહારાજશ્રી ગુરૂ કૃપાએ વંદનિય સાધુવર્ય બન્યા.

સાધુ પદે શ્રી દયાળદાસજી આવ્યા બાદ પૂજ્ય મહારાજ શ્રીએ તેમને પાટીદાર સમાજને ઉપદેશ આપી પીરાણા પંથથી છોડાવી શુદ્ધ સનાતન ધર્મ તરફ લાગણી પ્રગટે એવા પ્રચાર કરવા આજ્ઞા આપી.

એ ગુરૂ વચન માન્ય કરી તેઓશ્રી કચ્છ તેમજ ગુજરાતના પાટીદાર સમાજમાં પ્રચાર કાર્ય કરવા ઉપડયા. સંવત ૧૯૯૯માં ગુજરાતમાં આવેલા ગામ મોતીસરીવાળા પટેલ **હરીભાઈ કરમશીને** પોતાના વિચારો જણાવ્યા કે, કચ્છ પ્રાંતમાં પાટીદાર ભાઈઓની કૂળદેવીશ્રી શૈલપૂત્રી (ઉમીયા) નું મંદિર બંધાય અને દર વર્ષે એક વખત શ્રી જગદંબાનો ઉત્સવ થાય તો તે નિમિત્તે ધર્મનું પ્રચાર કાર્ય બહુ સરળ બને. આવી રીતે શ્રી હરીભાઈ અને મહંતશ્રી દયાળદાસજી મહારાજની વિચારણા નક્કી થઈ.

શ્રી હરીભાઈએ સહુ પ્રથમ રૂપિયા એક હજાર મંદિરના ફાળામાં નોંધાવ્યા. આ રકમ લઈ સંવત ૨૦૦૦ ના મહા સુદ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n11/mode/1up

realpatidar.com

પાંચમ(વસંત પંચમી) ના ઈશ્વર આશ્રમ વાંઢાય આવી પૂ. મહારાજશ્રી ઓધવરામજી તથા પટેલ રતનશી ખીમજી, પટેલ પરબતભાઈ લખમશી, પટેલ જીવરાજ વસ્તા, મુખી કાનજીભાઈ ગોપાલ તથા કરસન ઉકરડા વગેરે આગેવાનોને બોલાવી મહારાજ શ્રી ઓધવરામજીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું. ત્યારબાદ ગઢશીશાવાળા પટેલ રામજી લાલજી, વાલજી રામજી પટેલ, પટેલ ભીમજી કાનજી લુડવાવાળાની દેખરેખ અને ભાવનાથી શ્રી માતાજીના મંદિરનું કામ પરિપૂર્ણ થયું.

સંવત ૨૦૦૦ ના ચૈત્ર સુદ ૯ ના રોજ જગત જનની ઉમિયાજીની પ્રતિમાની વાંઢાય ગામમાં આવેલા જુના દ્વારામાં કે જ્યાં મહારાજશ્રી ઈશ્વરરામજી પોતાનું નિવાસ સ્થાન રાખી ભજન કરતા હતા એ આશ્રમમાં નૂતન મંદિર બંધાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

આ પ્રસંગ પૂર્ણ થયા પછી જૂના દ્વારામાં મુંબઈ નાગપુર વગેરે સ્થાનોમાં વસતા ભાવિકો તરફથી બીજા પણ કેટલાંક મકાનો બંધાઈ ગયાં અને મહંતશ્રી દયાળદાસજી મહારાજે પોતાનો નિવાસ પણ ત્યાંજ રાખ્યો. તેમના પટ્ટ શિષ્યશ્રી શાંતિદાસજી પણ અન્ય સાધુઓ સાથે રહેતા હતા.

મહારાજશ્રી ઓધવરામજીએ ઈશ્વર આશ્રમનો સંપૂર્ણ વહીવટ મહારાજશ્રી દયાળદાસજીને સોંપ્યો એટલે પોતાને નૂતન

realpatidar.com

realpatidar.com

આશ્રમમાં રહેવાની ફરજ પડી. શ્રી ઓધવરાજી મહારાજ મહાનિર્વાણ પામ્યા બાદ તેમને બાવાશ્રી વિહારી સાહેબ ની ગાદીના મહંત તરીકે અપનાવવામાં આવ્યા. મહંતશ્રી દયાળદાસજી મહારાજ પોતાના શિષ્ય શ્રી શાંતિદાસજી સિવાય અન્ય સંતોશ્રી સેવાદાસજી મહારાજ તથા સંતશ્રી ક રસનદાસજી મહારાજ વગેરે પરમ કૃપાળુ ગુરૂદેવની કૃપાદ્રષ્ટિ સાથે આશ્રમનો વહીવટ પણ ચલાવતા ગામનો જુનો આશ્રમ તેમજ શ્રી માતાજી ના મંદિરની વ્યવસ્થા તથા કબજો પણ સંભાળતા હતા.

સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ - ૩ ગુરૂવારના રોજ શ્રી ઉમિયા માતાજીના મંદિરની વ્યવસ્થા કરવા માટે કચ્છ તથા બહાર વસતા પાટીદાર ભાઈઓને મહંતશ્રી શાંતિદાસજી ગુરૂશ્રી દયાળદાસજીએ પોતાની હયાતીમાં વહીવટ ચલાવવા માટે સમિતિ નીમી જેનાં નામ નીચે મુજબ દર્શાવેલ છે.પટેલ ડાહ્યાભાઈ હરિલાલ,મોતીસર(ગુજરાત) પટેલ પરબત લખુભાઈ, મથલ પટેલ ભીમજી નાગજી, મથલપટેલ કરસન ઉકરડા, દેશલપર પટેલ કાનજી ગોપાલ દેશલપર તથા લુડવાના પટેલ રવજી વેલાણી.

VSAK 2021 Vaishakh Sudh 3 (Thursday) when converted comes to 04-May-1965 (Tuesday), which cannot be correct.

There seems to be error in the year. If the year is VSAK 2020 and rest is same then the date is 14-May-1964 Thursday.

We are therefore considering 14-May-1964

આ પ્રમાણે મહારાજશ્રી શાંતિદાસજીએ આ ભાઈઓને વહીવટી કાર્ય કરવા આજ્ઞા કરી અને પોતે પોતાનું શેષ જીવન ભજનાનંદમાં વિતિત કરવા લાગ્યા.

****

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n13/mode/1up

realpatidar.com

હરિદ્વાર આશ્રમ

સંત બડે પરમાર્થ શીતલ ઉનકે અંગ,
તૃષા બુઝાવત ઓરકી, દે દેવે અપના રંગ.

એ ઉક્તિ અનુસાર પરમ પૂજ્ય શ્રી ઓધવરામ મહારાજ ને એક એવો વિચાર થયો કે હરિદ્વાર - ઋષિકેશ બદ્રિકેદાર વગેરે તિર્થો કરવા જતા યાત્રીઓ માટે કંઈક સુવિધા કરવી જોઈએ, એ વિચાર એમના મનમાં ઘોળાયા જ કરતો હતો. ત્યાં હીરાપુર કંપા મુકામે પાટીદાર ભાઈઓનું મોટું અધિવેશન હતું ત્યાં ઉદ્દ્ઘાટન માટે પૂ. ઓધવરામજી મહારાજને બોલાવ્યા, પૂ. મહારાજશ્રી તે કાર્ય પૂર્ણ કરીને હરિદ્વાર પધાર્યા. અને ત્યાં ભજન કરવા માટે થોડી સુવિધા રહે એટલે સપ્ત સરોવર ઉપર ગુરૂ મહારાજ શ્રી લાલરામજીના નામથી રૂપિયા ૭૦ થી ૮૦ હજારના ખર્ચથી શ્રી કચ્છ લાલરામેશ્વર આશ્રમ સ્થાપ્યો જેથી કચ્છના યાત્રિકોને હરિદ્વાર અને બદ્રિકેદારની યાત્રાએ જતાં આવતાં ઉતરવાની સંપૂર્ણ સગવડ કરી આત્મ સંતોષ અનુભવ્યો.

હરિદ્વારમાં બાંધેલ કચ્છી લાલરામેશ્વર આશ્રમ પણ ગુજરાત અને કચ્છના પાટીદાર ભાઈઓને બોલાવી તેમની વ્યવસ્થાપક સમિતિ નીમી અને તે આશ્રમ સુપ્રત કર્યો. એ સમિતિના ભાઈઓના નામ નીચે મુજબ છે. પટેલ ડાહ્યાભાઈ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n14/mode/1up

realpatidar.com

હરિભાઈ, પટેલ વેલજી ભાણજી, પટેલ મૂળજી જીવરાજ, પટેલ વાલજી કાનજી તથા પટેલ દેવશી રામજી(ગુજરાતવાળા).

આશ્રમનો વહીવટ સોંપી અને મહારાજશ્રી વાંઢાય મુકામે પધારી શ્રી ગુરૂદેવની સમાધિના સાનિધ્યમાં ભજનાનંદમાં જીવન વીતાવવા લાગ્યા.

****

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n15/mode/1up

realpatidar.com

આરતી

ૐ જય જગદીશ હરે
પ્રભુ જય જગદીશ હરે
ભક્તજનોં કે સંકટ ક્ષણમેં દુર કરે ---------- ૐ જય

જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનસે મનકા
સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મિટે તનકા--- ૐ જય

માત-પિતા તુમ મેરે શરણ ગ્રહું કિસકી
તુમ બિન ઔર ન દુજા આશ ધરૂં જીસકી - ૐ જય

તુમ પુરણ પરમાત્મા તુમ અંતર્યામી
પાર બ્રહ્મ પરમેશ્વર તુમ સબ કે સ્વામી---- ૐ જય

તુમ કરૂણા કે સાગર તુમ પાલન કર્તા
મૈં સેવક તુમ સ્વામી કૃપા કરો ભર્તા------- ૐ જય

તુમ હો એક અગોચર સબ કે પ્રાણ પતિ
કિસ બિધ મિલું દયામય તુમકો મૈં કુમતિ - ૐ જય

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

દીનબંધુ દુઃખ હર્તા તુમ ઠાકુર મેરે
અપને હાથ ઉઠાઓ દ્વાર પડા તેરે --------- ૐ જય

વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા
શ્રધ્ધા ભક્તિ બઢાવો સંતન કી સેવા ------- ૐ જય

****

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n17/mode/1up

realpatidar.com

શ્રી ઈશ્વરદાસજી મહારાજની સ્તુતિ

શ્રી ગુરુ ઈશ્વર દેવ દયાનિધિ શરનાગત સુખકારી
સંશય શોક નશાવન પાવન મોક્ષ કરન ભવ ભયહારી

દે અસિ નિજ ઉપદેશ જ્ઞાન ગુરૂ સંશ્રૃતિ મૂલસહિત ટારી
ઈશ જીવ બીચ ભેદ છેદ કર ઉપદેશ જન અધિકારી

બોલત બચન સુધા કરવત નિત શિતલ મૃદુ અમૃતવારી
શરણ સુખદ પાલક ગુરૂ પદ્દરજ અધમ ઉદ્ધારન બ્રધ્ધારી

ગુરુ ગોપાલ વિચાર અખંડિત રામ રટન કર વ્રતધારી
સોહં શબ્દ ઉચ્ચારત અનુદિન, બોધ કરનકી ગતિ ન્યારી

જગ મંગલ મૂરતિ અતિપ્યારી, ગુરુ ઈશ્વર કર અવતારી
લાલ બાલ નિજ દાસ પાસ ભવ જલ તુરત લીયો તારી

****

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n18/mode/1up

realpatidar.com

ૐ

શ્રી સદગુરૂ સ્તવનમાલા

અનુષ્ટુપ છંદ.

ચૈતન્યં શાશ્વતં શાંતં, વ્યોમાતીતં નિરંજનં
નાદબિંદુ કલાતીતં, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

સર્વ શ્રુતિ શિરોરત્ન, વિરાજિત પદાંબુજં
વેદાંતાંબુજ માર્તંડં, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

અજ્ઞાન તિમિરાંધસ્ય, જ્ઞાનાંજન શલાકયા
ચક્ષુરૂન્મીલિતંયેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણુ, ગુરૂર્દેવો મહેશ્વરઃ
ગુરૂ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ધ્યાન મૂલં ગુરૂ મૂર્તિ, પૂજા મૂલં ગુરૂપદં
મંત્ર મૂલં ગુરૂ મૂર્તિ, મોક્ષ મૂલં ગુરૂ કૃપા

અખંડં મંડલાકારં, વ્યાપ્તં યેન ચરાચરં
તત્પદં દર્શીતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n19/mode/1up

realpatidar.com

ન ગુરોરધિકં તત્વં, ન ગુરોરધિકં પરં
ગુરોઃ પરતરં નાસ્તિ, તસ્માત્ સંપુજ્યતે ગુરૂઃ

અખંડાનંદ બોધાય, શિષ્ય સંતાપ હારિણે
સચ્ચિદાનંદ રૂપાય, રામાય ગુરવે નમઃ

અજ્ઞાન મૂલ હરણં, જન્મ કર્મ નિવારણં
જ્ઞાન વૈરાગ્ય સિધ્યર્થ ગુરૂ પાદોદકં પિબેત

મંદાક્રાંતા છંદ

બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાન મૂર્તિ
દ્વંદ્વાતીતં ગગન સદૃશં તત્વમત્યાદિ લક્ષ્યં
એકં નિત્યં વિમલમચલં સર્વ ધિ સાક્ષીભૂતં
ભાવતીતં ત્રિગુણ રહિતં સદગુરૂ તં નમામિ

સોરઠા

વસ્તુ ગતે સો એક, યામેં કછુએ ભિન્ન નહિ
હરિ ગુરૂ સંત વિવેક, નામ મનોહર મુર કહે

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n20/mode/1up

realpatidar.com

નારાચ છંદ

હરી ગુરૂ જુ એક હે, વિવેકસોં વિચારજે
કરી કૃપા કૃપાલકી, જુ આપકોં ઉધારજે
લહે જુ ભેદ જ્ઞાનકો, અજ્ઞાન અંતરા તજે
અખંડ રૂપ આતમા, ભલી જુ પ્રીતસોં ભજે

ન દુર હૈ નજીકસો, ન નીલ પીત રંગ હૈ
ન શ્વેત શ્યામ કો કહે, ન બાલ વૃદ્ધ અંગ હૈ
ન પાર હૈ અપારકો, ન વૈખરી પિછાનહી
સદા અસંગ આતમા, પરાત્ પાર માનહી

કયો પરાત્ પાર હૈ, લખે ન કોઈ ભેવકોં
અનામયં અચીંત હૈ, દ્રશ્યો ન જાત દેવકો
અગાધ સંતકો મતો, કથ્યો ન જાત કયોં કહે
યથા મતી જુ ભાખહીં, લેખ્યો જાત ક્યોં લહે

ગુરૂ જબેં કૃપા કરેં, તબેં સુતત્વકોં લહે
મિટે અજ્ઞાન આનકોં, દુરીતકોં, દુરી દહે

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n21/mode/1up

realpatidar.com

લખે જુ સાચ સારકો, અસારકોં ન ધાર હી
ગ્રહી જુ જ્ઞાન કેવલં, અજ્ઞાનકો નિવારહી
લખ્યો સ્વરૂપ બ્રહ્મકો, ચરાચરં જુ દેખહી
ભિન્નાભિન્નં ન ભાવ હે, ન કાહુકોં ઉવેખહી
હરી હરી જુ દર્શહી, હરી વિના ન આન હૈ
હરી હરી જપેં સદા, હરી હરી સુ ધ્યાન હૈ

હરી હરી જુ બોલહી, હરી હરી સુ ધ્યાવતે
હરી હરી વખાન હૈં, હરી હરી સુ ગાવતે
હરી હરી જુ ચીંતવે, હરી હરી સુ માનતે
હરી હરી જુ વંદહીં, હરી હરી પિછાનતે

અચિંતરૂપ આતમા, સ્વરૂપ સો ધરે સદા
વૃત્તિ અડોલ વારધી, ન કાહુપેં ચલે કદા
તપે રવિ નિદાનકો, કછુ ન ઉષ્ણ લાગહી
મતો અપાર જ્ઞાનકો, જુ તાહિકું ન ત્યાગહી

પ્રમાણિકા છંદ

ન કામ ક્રોધ લોભ હૈ, ન સોભકો અસોભ હે
ન મોહ દ્રોહકોં કરેં, ન ભેદભાવ ના ઘરેં

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n22/mode/1up

realpatidar.com

સબેં જુ દ્વૈત ત્યાગહીં ન સંગ દોષ લાગહીં
તજે ન બેદ આમના, કરૈં ન મન કામના

દોહા

જ્ઞાની ગુરૂકો વંદીયે, જુગલ જોરિકે પાન
રવિ હરત જ્યોં તિમિરકોં, ગુરૂ હરે અજ્ઞાન

પ્રાપતી જે પરિબ્રહ્મક, જાકે વચનતે હોય
તાકી પદરજ પરસિયેં, ગુરૂ સમ આન ન કોય

જિનહીંકે અજ્ઞાન કરિ, ભાસત માયા ભાસ
સત સ્વરૂપકે જ્ઞાનતે, દીસે બ્રહ્મ વિલાસ

જ્ઞાનિકે ઉપદેશતેં, મિલે પરિબ્રહ્મ રાય
દેવા ગુરુ ધન ધન્ય હૈ, વંદન યોગ્ય સદાય

પ્રથમ કરો કર જોરિકે, ચરન કમલકી સેવ
વિઘન હરેં મંગલ કરેં, જય જય જય ગુરૂદેવ

જો પરહીં ગુરૂ ચરનમેં, સો તરહીં તતખેવ
તો ફીર ઉદર ન આવહીં, જય જય જય ગુરૂદેવ

realpatidar.com

realpatidar.com

ગુરૂ વિન સંશય ના મિટે,ગુરૂ વિન મિલે ન ભેદ
ગુરૂ વિન જ્ઞાન ન ઉપજે, જય જય જય ગુરૂદેવ

જ્ઞાની ગુરુ પરસાદતેં, પરી ભજનકી ટેવ
લાગી લગન લોચન ખુલૈં, જય જય જય ગુરૂદેવ

પરા પાર પરિબ્રહ્મજે, અક્કલ અખંડ અભેદ
તિન વપુ ધરી કરૂણા કરી, જય જય જય ગુરૂદેવ

ધરે ધ્યાન ગુરૂ દેવકો, ધ્યાવે અંગ અવેવ
સો પાવે મહા મુક્તિસુખ, જય જય જય ગુરૂદેવ

ભયો પ્રકાશહિં બ્રહ્મકો, ગયો સકલ અહમેવ
અંતર ઉદયો આતમા, જય જય જય ગુરૂદેવ

ગુરૂ સોઈ પરિબ્રહ્મ હૈ, ગુરુ નિરંજન એવ
વ્યારી પદ વંદન કરે, જય જય જય ગુરૂદેવ

ચોપાઈ

નમો નમો ગુરૂ દેવ ગુંસાઈ
મૈં આયો તુમરી સરનાંઈ

realpatidar.com

realpatidar.com

તાતેં કરોં વિનય કર જોરી,
નાથ યથા મતિ સામ્રથ મોરી

પશ્ચિમ ખંડ ધરા કચ્છ દેશ,
ત્યાં સદગુરૂ દેહ ધર્યો નરેશ
હમલા ગામ સુથાનક વાસા,
જ્યાં સુખ પાવે સંત્ નિવાસા

ત્યાં પ્રગટે ગુરૂ સાહેબ દેવા,
પૂરન બ્રહ્મ અખંડ અભેવા
યાદવ કુલમેં ભએ અવતારા,
જીવ અનેક ઉધારન હારા

જન્મ ધર્યો જીવનિકે કારન,
તાકોં સદ્દગુરૂ આએ તારન
માતપિતા કુલ કુટુંબ પ્રવારા,
તાકોં સદગુરૂ તારન હારા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n25/mode/1up

realpatidar.com

ધન ધન માત પિતા ધન બંધુ
જા ઘર પ્રગટે કરૂણા સિંધુ
ધન સો નગર બસૈ જા માંહીં
તામેં લોક વસેં ધન તાહીં

ધન ધન શિષ્ય કરેં જો સેવા,
તા પર કૃપા કરે ગુરૂ દેવા
સેવક સંગ રહે સો ધન હૈ,
જાકોં રાત દિવસ દરશન હૈ

ધન ધન ભુમિ જહાં વિચરહી,
તા ભુમિકોં પાવન કરહીં
જો કોઈ ચંદન પુષ્પ ચડાવે,
તો પ્રિયતા મનમેં નહિ આવે

જો કોઈ કુટિલ વચન મુખ દાખે
તાકો દોષ હ્રદે નહિ રાખે
શિતલ શાંત સદા સ્થિર માના
બ્રહ્મ વિના દેખે નહિ આના

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n26/mode/1up

realpatidar.com

બ્રહ્મ ભાવ કરી બ્રહ્મ પિછાન્યો
બ્રહ્મ અરૂ આપ એક કરિ જાન્યો
તાતેં બ્રહ્મરૂપ ગુરૂ દેવા,
અકલ અખંડ અનંત અભેવા

જો નિર્ગુન નિર્ભેદ નિરંજન
સો મેરે ગુરૂભવ દુઃખ ભંજન
એક અજન્મા જો અવિનાશી
સો મેરે સદ્ગુરૂ સુખરાશી

એક અખંડિત અકલ અમાપક
સો મેરે ગુરૂ ઘટ ઘટ વ્યાપક
જો ચિદ્રૂપ ચલે નહિ ડોલે
સો મેરે ગુરૂ ઘટ ઘટ બોલે

જો વ્યાપક જલ થલકે માંહી,
સો સદગુરૂ દુજા કો નાહીં
તાતેં એક આદિ મધ અંત,
સદગુરૂ આપ સ્વયં ભગવંત

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n27/mode/1up

realpatidar.com

જો વ્યાપક જંલ થલકે માંહીં
સો સદ્‌ગુરૂ દુજા કો નાહીં
તાતેં એક આદિ મધ અંત
સદ્‌ગુરૂ આપ સ્વયં ભગવંત

ગુરૂ ગોવિંદ ગુરૂ સોઈ રામા
એકહિં રૂપ ધર્યા દોઈ નામા
દેવા સદ્‌ગુરૂ સાહેબ મેરા
ભેટત ચરન મિટયા ભવ ફેરા

દેખી દીન દયા મન આની
કરી કૃપા જન અપનો જાની
જન વિહારી ગુરૂ મહિમા ગાવે
સકલ સંતકોં શિશ નમાવે

દોહા

વ્યાપક સબ ઘટ આતમા, જાકો આદિ ન અંત
સો મેરે ઉર નિત વસે, જય જય ગુરૂ ભગવંત.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

જાકોં ગાવત વેદ નિત, અકલ અખંડ અનંત,
સો મેરે નિજ આતમા, જય જય ગુરૂ ભગવંત.

જુઠા કલ્પીત જીન વિષે, સકળ ચરાચર જંત,
સમ રસ ખેલે સબનમેં, જય જય ગુરૂ ભગવંત.

સબ જડ ઈંન્દ્રિય જીનહિંતે, વ્હે ચેતન વરતંત,
સોઈ પ્રગટ પરમાતમા, જય જય ગુરૂ ભગવંત.

ખોજ્યા જીન ખાંખત કરી, તિન પાયા નિજ તંત,
પાયા ગુરૂ પરસાદતેં, જય જય ગુરૂ ભગવંત.

ગુન નિર્ગુન નહીં જીન વિષે, સોઈ સબ ગુનવંત,
તવ સો દૂજા ક્યા કહેં, જય જય ગુરૂ ભગવંત.

ઐસે આતમ તત્વકોં, જો સમજે સો સંત,
સો ઉત્તમ હૈ સબનિતેં, જય જય ગુરૂ ભગવંત.

સમજ્યા સમજી ત્યાં સમ્યા, માનુભાવ મહંત,
વિહારી વંદન યોગ્ય હૈ, જય જય ગુરૂ ભગવંત.

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n29/mode/1up

realpatidar.com

ચૌપાઈ.

ઈનકો પઠન પ્રાત ઉઠિ કરહીં
ગુરૂકે ચરન કમલ ચિત ધર હીં
યહ ગુરૂ મહિમા સુને સુનૌ
તાકોં ફેર જન્મ નહિં આવૈ.

કુંડલીયા.

દેવા યહ વર દીજીયેં, ઉપજે આતમ જ્ઞાન,
ચરન તુમારે ચિત બસેં, ધરોં નિરંતર ધ્યાન,
ધરો નિરંતર ધ્યાન, અવર ઈચ્છા નહીં કોઈ,
દુર્લભ યહ વરદાન, દયા કરિ દીજૈં સોઈ,
કહે વિહારી કર જોર, સદા સંતનકી સેવા,
ઉપજે આતમ જ્ઞાન, દીજીયેં યહ વર દેવા.

અથ પરંપરા ગુરૂ પદ્ધતિ.

દોહા.

સત ચિત્ આનંદ રૂપ નિજ, નામ રૂપ જગ દ્વંદ
પ્રથમ વસ્તુ નિર્દેશ યહ મંગલ નિજ સુખ કંદ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n30/mode/1up

realpatidar.com

દ્વિતીય વંદના રૂપ જો, મંગલ શુભ નિહકામ,
મન તન ધન કુરબાન કરી, વંદો સદ્‌ગુરૂ રામ

તૃતિય મંગલા ચરણ જો, સ્તવન રૂપ પુનિ હોય,
ગુરુ સબનીતે શ્રેષ્ઠ હૈ, ગુરુ સમ આન ન કોય

મંગલ ત્રય યુત નમન કરિ, સંપ્રદાય અનુસાર,
પરંપરા ગુરૂ પદ્ધતિ, તાકો કરો ઉચ્ચાર.

ગંભીર ચોપાઈ

ચિદાનંદ સતબ્રહ્મ, પ્રગટ પરમાતમ દેવા,
અકલ અચિંત અનામ અરૂપ અજીત અભેવા,
આપહિ અપની શક્તિ તાંહિતેં જગ ઉપજાયો,
થિર ચરકો આધાર શ્રુતિ નારાયણ ગાયો

નારાયણકે નાભિ કમલ પ્રગટે ચતુરાનન,
બ્રહ્મરૂપ પ્રતિપાદક ચારો વેદ પરાયન,
તપો નિધી પ્રગટે તિનંતે મુનિ ગુરૂ વશિષ્ટ
બ્રહ્મભૂત કરૂણાકે સાગર સકલ વરિષ્ટ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n31/mode/1up

realpatidar.com

શક્તિ મુનિ પ્રગટે તિનતેં પરમદભૂત જ્ઞાની,
ચિદાનંદમય સમરસ મહા મંગલ વિજ્ઞાની,
શક્તિ તનય મહારાજ પરાસર તપકે આગર,
બ્રહ્મલીન મન સદા સદોદિત સુખકે સાગર.

પુત્રરૂપ દેહ પ્રગટ ભયો તિનતેં ગુરુ વ્યાસ,
વેદ મંથન કરિ બ્રહ્મસૂત્ર જીન કીયો પ્રકાશ,
ભારત ઈતિહાસાદિક અષ્ટાદશહિં પુરાના,
ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ વરણાશ્રમ નાના,

વ્યાસ પુત્ર યોગીંદ્ર વિરાગી શુક મહારાજા,
સપ્ત અહર્નિમે કીનો મુક્ત પરિક્ષત રાજા,
શિષ્ય તિનહિંકે ગૌડ પાદ આચાર્ય જાનો,
પ્રગટ કિયો સન્યાસ ધર્મ બહુ દિન અલપાનો.

યોગ ઈંદ્ર ગોવિંદાચાર્ય તિનકે શિષ્ય,
શરણાંગત જન મેટનહારે ભૂત ભવિષ્ય,

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n32/mode/1up

realpatidar.com

તિનકે શંકર આચાર્ય સબ જગ સુખ કંદા,
કરી દીનો પ્રસ્થાન જક્તમેં મેટયો દ્વંદા.

કરી દિગનિમેં વિજય બોધ પાખંડ ઉડાયો,
એક બ્રહ્મ અદ્વૈત સબલ મત સબની દ્રઢાયો,
સૂત્ર શ્રુતિ સ્મૃતિ વાક્ય વ્યવસ્થા કીન યથાર્થ,
ગૌન પદાર્થ તીન મુખ્ય કરી મોક્ષ પદાર્થ

ચાર શિષ્ય તિનકે પરમદ્દ્ભૂત અકામ,
પરંબ્રહ્મ લયલીન કહું અબ તિનકે નામ,
પ્રથમ પદ્મ પાદાચાર્ય તમ ભ્રાંતિ દિવાકર,
દ્વિતિય સુ હસ્તામલક બ્રહ્મ અનુભવ રત્નાકર.

તૃતિય ત્રોટકાચાર્ય શરણાંગત સુખદાયક,
ચતુર્થ વાર્તીકકાર તજ્ઞ જન ભજવે લાયક,
પ્રગટ ભયે તિનતેં દશનામી શિષ્ય ધુરંધર,
દૂર કરન મારૂત સમ જગતમ મેઘ અડંબર.

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n33/mode/1up

realpatidar.com

તીર્થાશ્રમ પુનિ વનારન્ય ગિરિ પરવત સાગર,
સરસ્વતી ભારતી પુરી મહા બુદ્ધિ કે આગર,
સરસ્વતી કુલ રામ અખંડાનંદ ગુસાઈ,
સકલ ચરન રજ વાર વાર વંદો શિર નાઈ.

સંપ્રદાય અનુસાર પ્રતાપી સંત મહંત,
યથામતી કછુ કહું કહત નહિં આવે અંત,
નાનક દાદૂ દેવ અખાજી સુંદરદાસ,
નરહર મનહર દાસ રજબ નિજ રૂપ પ્રકાશ.

નિરંજની ભગવાનદાસ શુકદેવ પ્રતાપી,
હરસુર પુનિ સહદેવ સ્વામી રણછોડ અઘાપી,
હમલા મહું પ્રગટે ગુરૂ દેવા સાહેબ જ્ઞાની,
ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત અનુભવકી ખાની.

તિનકે જેઠીરામ વિહારી સેવારામ,
બુદ્ધિવાન ગુરૂ રામસિંહજી ક્ષેમ અભિરામ,

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n34/mode/1up

realpatidar.com

ગુરૂ ઈશ્વર સુખધામ કામ ક્રોધદિક ટારે,
પ્રબલ બોધ ઉર સોધ શિષ્ય ભવ ફંદ નિવારે

ગુરૂ મોહન સુખ રૂપ ભૂપ વંદત જેહી ભારી,
સંપૂરણ નિજ જ્ઞાન ધ્યાન પૂરણ સુખકારી
પ્રગટે પૂરનરામ આન શુકદેવ સમાના,
શ્રી ગુરૂ ગરિબ નિવાજ કહત નહિ બનેબખાના,

બોલત વચન રશાલ જીહજિમિ અમૃત ઝરન,
મહિમા અપરંપાર જાસુ જગમંગલ કરની.
ચાર જુગનિકે સંત જક્તમહું પર ઉપકારી
વાર વાર વંદો તીનકી પદરજ શિર ધારી,

નારાયન ગુરુ સંત ભેદ મતિ યામેં નાહીં,
કથન માત્ર ત્રય નામ વસ્તુતે એકે આંહીં,
એસો યહ અદ્વૈત જ્ઞાન સદગુરૂતેં પાયો.
અહં બ્રહ્મ અસ્મી અનુભવ અતિ અડિગ દઢાયો

realpatidar.com

realpatidar.com

અવર યુક્તિ દષ્ટાંત પ્રક્રિયાકી બહુ રીતી
કરિ વિચાર બાપૂ જ્યોંકો ત્યોં નિજ પદ પાયો
નિજાનંદમય વસંવેદ ચિદ્દઘન તન છાયો

કુંડલિયા.

નારાયણ ગુરૂ સંત પદ, વંદો વારંવાર
તારક ભવજલ ઉદધિકે, દાયક શુધ્ધ વિચાર
દાયક શુધ્ધ વિચાર, સાર પરમાતમ પ્રાપક
અગમ અગોચર અકહ રહિત જો વ્યાપ્ય રૂ વ્યાપક
જન બાપૂ સદગુરૂતેં પાયો રહિત ત્રિવિધ હદ
વંદોં વારંવાર સંત ગુરૂ નારાયણ પદ
રામ ગુરૂ ચિત રાખીયેં, નિત તવ પદકો નેહ
સત પરચા સત સંગતી , જન્મ કર્મ કટ જેહ
જન્મ કર્મ કટ જેહ, એહ નિજ જ્ઞાન અખંડિત
શ્રવન મનન અતિસાર, પાર સબ હો ગયે પંડિત
બાપુકે તુમ બાપ, કૃપા ધન પૂરણ કામ
નિત તવ પદકો નેહ, રાખિયેં સદગુરૂ રામ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n36/mode/1up

realpatidar.com

અથ શ્રી કૃષ્ણ છબિ વર્ણન.

દોહા

અદ્દભુત છબિ આનંદમય, મેરે જીવન પ્રાન
જન વિહારિ કર જોરિ જુગ, બહુર્યો કરોં બખાન

દ્વી અક્ષરી છંદ.

બહુરી કરોં પ્રભુકી છબિ બરનન,
ચિત મેરો લાગો જીન ચરનન
યથા યોગ્ય હૈ યહ છબિ જેસેં
કહી ન જાત કવિ બરતન કેસેં

શ્યામ સ્વરૂપ સુભગ તન સુંદર,
પ્રજાધીશ વ્રજ નટ નાગર વર
ચરણન કરત ચારૂ નેપુર ધુન,
હોત અધીર ધીર યહ ધુન સુન

realpatidar.com

realpatidar.com

સુંદર જુગલ જાનું જંગા વર,
કટિ તટ કટિ મેખલા મનોહર
અદભુત ઉદર બીચ નાભી અધ,
મનહુન ભમર પરત જલકેમધ

બનિ વિસાલ ઉર માલ મનોહર,
શુભ ગુન સકલ સદન સુંદર વર
અતિ કપોત કર કંઠ વિષે,
તા બિચ રૂચિર બની ત્રય રેષા

પુનિ પ્રચંડ ભુજ દંડ બાહુબલ,
ખેદ લહે જિનતે કેવલ ખલ
રત્ન જડીત કર કંકન રાજે,
બાહન બાજુબંધ બિરાજે

અધિક અધિક પલ પલ છબી આનન,
મકરાકૃત કુંડલ છબી કાનન

realpatidar.com

realpatidar.com

ચારૂ ચિબુક જુગ દસન પાંતિવર,
નવલ નાસિકા શુભ અતી સુંદર

ગુલિક જુગલ ગંડસ્થળ સોહન,
મુસકન હસન મદન મન મોહન
ચંચલ ચપલ ચારૂ જુગ લોચન,
પર્મ દયાલ દીન દુઃખ મોચન

રૂચિર ભાલ ગોરોચન રેષા,
બની લલાટ બીચ બીંદી વિશેષા
પેચદાર પગરી શીર શોભીત,
જીન અતિ કીન મદન મન ક્ષોભીત

મનિ જડીત શિર મુકુટ મનોહર,
તા બીચ લસત લલિત મુક્તાવર

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n39/mode/1up

realpatidar.com

અંગ અંગ અંબર વર ભુષન,
જીનકે દર્શ મિટે સબ દુષન

કોટી કોટી મંગલ મય મૂરત,
સુકૃત કોટી સદન યહ સૂરત
અતિ વિચિત્ર લિલા વિસ્તારન,
યદુ કુલ જન્મ ધર્યો જન કારન

અજર અમર ગુન અગુન ગુસૈયાં,
સો પ્રભુ ચારત બન બન ગૈયાં
શ્રુતિ પુરાન કૌ પાર ન પાવે,
સો પ્રભુ ગ્વાલની ગ્વાલ હંસાવૈ

જીનકોં યોગેશ્વર નહીં જાનૈ,
સો લલના રસરૂપ લુભાનૈ
જીનકોં શિવ સનકાદિક ધ્યાવૈ,
સો પ્રભુ ગ્વાલનિ સોં મીલી ગાવૈ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n40/mode/1up

realpatidar.com

દોહા

સુખદ સિંધુ અવતાર સબ, રત્ન કૃષ્ણ બલરામ,
સોબસહૌ મમ ચિંત સદન, ધ્યાન યોગ છબી ધામ.

અથ ચોવીશ ઈશ્વરાવતાર નામ ચૌપાઈ.

જય જય આદિ વરાહ, મીન વામન મન્વંતર,
સનકાદિક નરસિંહ દેન વર ધ્રુવ ધન્વંતર,
કપિલ કમઠ હયગ્રીવ, હંસ હરિ નર નારાયન,
ઋષભ દેવ રઘુવીર, કૃષ્ણ પરિબ્રહ્મ પરાયન,

બુધ નિકલંકી વ્યાસ, પૃથુ પૃથવીકે ઈશ,
પરશુરામ અભિરામ યજ્ઞદત્ત એ ચોવીશ,
તિનકે પદ અરવિંદ, વંદ પુની વંદન કરહોં,
તિનહિ ચરનકી રેનુ, સદા મેરે શિર ધરહોં.

પાદકિ રેનું પ્રસાદ, ખુલે અનુભવકે લોચન,
દેખ્યા ચૈતન્ય બ્રહ્મ ભયા જીનતેં ભવ મોચન,
અબ ન પરોં ભવ કૂપ, રૂપ નિજ અપના પાયા,
દેવા ગુરૂ દયાલ, દયા કરિ મોહિ બતાયા.

realpatidar.com

realpatidar.com

અથ ગુરૂ સ્તુતિ

સોરઠા.

દેવા ગુરૂ દયાલ, સાહેબ મેરે ઉર સદા,
કર્મ ભર્મ અરૂ કાલં, ઉડ ગએ જીનકે વચનતે.

મહા વાક્યકો બોધ, મોહિ દિયો ગુરૂ મહેર કરી.
લિયો સ્વરૂપહિં સોધ , ભાગ ત્યાગ લક્ષણા કરી.

દોહા.

પતિત ઉધારન મહા પ્રભુ દયા સિંધુ ગુરૂ દેવ,
સેવા રામ જાચેં સદા, ચરન કમલકી સેવ

ચરન કમલકો ધ્યાન પ્રભુ, દીજે દ્રઢ ઉપર માંહિ
જાચક જાચત શ્રી ગુરુ, ભીખ એહિ તુમ પાંહિ

તુમ દાતા ત્રય લોકકે, સદગુરૂ સદા કૃપાલ
ભાવ ભક્તી ભીક્ષા ચહોં, દીજે દીન દયાલ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n42/mode/1up

realpatidar.com

ભટકી ભટકી દેખે સબૅ, કલ્પીત પંથ અપાર
ઉલટે બંધનમેં પરે, કોઈ ન છોડાવનહાર

ભ્રમત ભ્રમત આઈ પર્યો, સદગુરૂ તો દરબાર
કૃપા દ્રષ્ટી કીજે પ્રભુ, પકરી ઉતારો પાર

તુમ બીન હમરો કો નહીં, અવર વસીલો કોય
તાતેં સંત ગુરૂ રાખીય, સરન અપની મોય

સદા હમારે ચીત બસો, બીસરો એક ન લગાર
તુમપૈં માગા ँ શ્રી ગુરૂ, તુમરા ે ધ્યાન ઉચાર

તુમરે યશ નીત ગાવહોં, તુમરે ગુન અરૂ ગીત
સત ગુરૂ તુમરે પાદસોં, ઉમગે નીત નીત પ્રીત

કુંજી ઈંડા જ્યોં તજે, આપ બસે પરદેશ
સત ગુરૂ એસેં રાખીયેં, સુરતીમાંજ હમેશ

સુરતિં બીના નીપજે નહીં, શીશુ ઈંડા ગલી જાય
તાતેં તુમહી દયાલ ગુરૂ, હોજો સદા સહાય

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n43/mode/1up

realpatidar.com

પ્રાર્થના યહ જો કરી, સતગુરૂ ધરજો કાન
સેવારામ પ્રણવે સદા, મેરે જીવન પ્રાન

દેવા દરશન દીલહીમેં, પલ પલ દીજે મોહી
એક નીમીષ નહીં ભૂલ હોં, સ્વામી છબહીં તોહી

સૂરત તુમરી સતગુરૂ, છીન ઈક વીસરત નાહી
મહા લલિત છબી લીખ ધરી મન મંદીરકે માંહી

દેવા મેરી અરજી ઈક, સુનિઓ દે કરી કાન,
નેહ નિભે સો કીજીયેં, કૃપા સિંધુ ભગવાન

વાણી વચન વિલાસત, નહિં પાવ નિજ ભેવ
વિહારી વસ્તુ તા મિલ, કૃપા કરૈ ગુરૂ દેવ

સેવા રામ સેવા સંતકી કરે જુ મન ચિત લાઈ
સો પાવૈ મહા મુક્તિ સુખ યામેં સંશય નાંઈ.

ગુરુ કૃપાતેં પાઈયેં ચરન કમલકી સેવ
સેવારામ મુખ બોલીયેં જય જય જય ગુરૂદેવ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n44/mode/1up

realpatidar.com

ધ્વની

જય ગુરૂદેવા જેઠીરામ,
રામસિંહ ગુરૂ દેવ નમામ.
હરસુર સ્વામી રણછોડરામ,
પરમાનંદ ગુરૂ એક અનામ

વિહારી ક્ષેમ ગુરૂ સેવારામ,
ગુરૂ ઈશ્વર સ્વામી પૂંજારામ.
અખંડાનંદ જય જય રામ,
સદ્દગુરૂ રામ પુરનકામ.

દત્ત દિગંબર જય રઘુનાથ,
ગુરૂવર સ્વામી શ્રી મુનીનાથ.
હરિ નારાયણ ગુરૂ નારાયણ,
દ્વૈત નિવારણ પરમાનંદ.

સદાશિવ શંકર ભક્ત જન,
પ્રિય પંકજ લોચન,
નારાયણ તવ દાસો હં.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n45/mode/1up

realpatidar.com

બોલો શ્રી દ્વારિકાનાથ કી જય
ગુરુ ગોસાંઈ કી જય
બાવા દેવા સાહેબ કી જય
બાવા વિહારી સાહેબ કી જય
બાવા ક્ષેમસાગર કી જય
મહારાજ શ્રી ઈશ્વરરામજી કી જય
મહારાજ શ્રી ઓધવરામજી કી જય
મહારાજ શ્રી દયારામજી કી જય
મહારાજ શ્રી શાંતિરામજી કી જય
સાધ્વી મૈયા કી જય
ચાગબાઈ માતા કી જય
ગંગા મૈયા કી જય
જમુના મૈયા કી જય
કેદારનાથ કી જય
બદ્રિવિશાલ કી જય
અપને અપને ગુરુ ગોસાઈ કી જય
સંધ્યા આરતી કા જય જય સીતારામ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n46/mode/1up

realpatidar.com

જય ગુરૂ દેવા ઈશ્વરરામ
લાલરામ ગુરુ કરૂણાધામ
જય ગુરુ દેવા ઓધવરામ
ગુરુ દીનદયાળ પરમ સુખધામ
જય ગુરુ દેવા શાંતિરામ
ગુરુ અવિનાશી પરમ સુખધામ

શ્રી ઈશ્વરરામજી મહારાજની સ્તુતિ

એક એવ અદ્વૈત જો, પરમાત્મા જગદીશ,
જંન કારણ તનુ ધારિવર, જય જય સદગુરૂ ઈશ---

મનહુ અપર બિરાજ હી, રઘુપતિ ગુરૂ મુનીશ,
જ્ઞાન દાન નિત દેતવર, જય જય સદગુરૂ ઈશ---

પૂરણ કામ નિષ્કામ મતિ, સમજહીં રંક મહીશ,
જ્ઞાન ભાન મતિમાન અતિ, જય જય સદગુરૂ ઈશ---

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n47/mode/1up

realpatidar.com

સદા વિચારત લક્ષ્ય જો, તજી ભ્રમ ઈશ અનીશ
પુનિ પુનિ ભાષત શિષ્ય પ્રતિ, જય જય સદગુરૂ ઈશ---

દાતા જ્યોં નિજ મુક્તિ કે, કરૂણા કરકા શિષ
શરન હરન ભવ ભીતી ભલ, જય જય સદગુરૂ ઈશ---

મોક્ષ કીયો જ્યોં ગ્રાહતે, હરિ તત્ કાલ કરીશ
કીનો બંધ વિચ્છેદ મમ, જય જય સદ્‌ગુરૂ ઈશ---

નિગમા ગમ જેહી ગાવહી, મન પર કહત મુનીશ,
સોઈ લખાવત લક્ષ જો, જય જય સદગુરૂ ઈશ---

નિગમાગમ સબ જાસુ ઉર, વસત વદન વાગીસ
રિદ્ધિ સિદ્ધિ રહત સો પાદતલ, જય જય સદગુરૂ ઈશ---

નિજાનંદ નિમગ્ન જો, વર વરિયાન વરીશ,
જગમંગલ કર જાસુ દ્રગ, જય જય સદગુરૂ ઈશ---

સોહત સુઠીવર સુભગ ષટ, મનહુ માયાધીશ
રમત રમાવત આપ સબ, જય જય સદગુરૂ ઈશ---

શરણ સુખદ ભય હરન ભવ, અઘરન ઘરન ગિરિશ,
અશરન શરન ન અપર જન, જય જય સદગુરૂ ઈશ---

realpatidar.com

realpatidar.com

મહિમા અગમ અગાધ અતિ, બરણી ન શકત ફનીશ,
સામ કહાં એક મુખ ભને, જય જય સદગુરૂ ઈશ---

ઈશ્વર ઈશ્વર રૂપ હોઈ, લીંન મનુજ અવતાર
આરયવરતર પુજ્ય મમૂ, નિજ જન કીન ઉદ્ધાર---

સિયાવર રામચંદ્ર કી જય

રાધેશ્યામ કૃષ્ણ દેવ કી જય

ઉમાપતિ મહાદેવ કી જય

પવનસુત હનુમાન કી જય

બોલો ભાઈ સબ સંતન કી જય.

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n49/mode/1up

realpatidar.com

આરતી

આનંદ મંગલ કરૂં આરતી,હરિ ગુરૂ સંતની સેવા
પ્રેમ ધરી મંદીરે પધરાવું, સુંદીર સુખડા લેવા---

ત્રિભુવન તારણ જગત ઓધારણ,
જેના મુખે મીઠા મેવા;
સંત મળે તો મહાસુખ પામે,
ગુરૂજી મળે મીઠા મેવા

અડસઠ તિરથ સંતોને ચરણે,
ગંગા યમુના રેવા---
જેને આંગણે તુલસીનો કયારો,
શાલીગ્રામની સેવા---

મોર મુગુટ શિર છત્ર બિરાજે,
આવ્યા દર્શન દેવા;
કહે 'પ્રિતમ' ઓળખો એંધાણે,
હરિના જન હરિ જેવા---

****

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n50/mode/1up

realpatidar.com

આરતી

પહેલી રે આરતી શ્રી ગણપતિ દેવ તમારી,
રિદ્ધિ સિદ્ધિ નારી આરતી ઉતારે તમારી

ભવોભવ ભક્તિ દેજો દેવ મુરારી
જન્મો જન્મ ભક્તિ દેજો કૃષ્ણ મુરારી-------- ભવોભવ

બીજી રે આરતી શ્રી શંકર દેવ તમારી
ગંગા ને પાર્વતી આરતી ઉતારે તમારી ------- ભવોભવ

ત્રીજી રે આરતી શ્રી રામચંદ્ર દેવ તમારી
સતી રે સીતાજી આરતી ઉતારે તમારી-------- ભવોભવ

ચોથી રે આરતી શ્રી હનુમંત દેવ તમારી
સર્વે રે જગતમાં રહ્યા બાલ બ્રહ્મચારી ------- ભવોભવ

પાંચમી રે આરતી શ્રી કૃષ્ણ દેવ તમારી
રાધાને રૂક્ષ્મણી આરતી ઉતારે તમારી ------ ભવોભવ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n51/mode/1up

realpatidar.com

સ્તુતિ.

શ્રી ગુરૂદેવ ઓધવરામ તમને વારંવાર પ્રણામ,
તમને વારંવાર પ્રણામ, પ્રભુ છો અંતરના આરામ

પાવન નામ પવિત્ર તમારૂં ઉર અજ્ઞાન તિમિર હરનારૂં
એક જ ઠરવાનું છે ઠામ, તમને વારંવાર પ્રણામ

ગુરૂ અદ્ભૂત શક્તિ તમારી નિજ મહિમા કેરી બલીહારી
કીધાં પરોપકારી કામ, તમને વારંવાર પ્રણામ

ઘટ ઘટ જ્યોત તમારી ઝલકે તેજ તમારૂં સઘળે છલકે,
ગુરૂ છો સ્વયં જ્યોતિ સુખધામ તમને વારંવાર પ્રણામ

અનીતિ અધર્મની જડ શુદ્ધ સ્વધર્મ સનાતન સ્થાપી
કર્યું જીવોનું કલ્યાંણ, તમને વારંવાર પ્રણામ---

દાસ દયાળ કહે કર જોડી ભવ ભય બંધન નાખો તોડી
હૃદયમાં વસજો આઠો જામ, તમને વારંવાર પ્રણામ-

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n52/mode/1up

realpatidar.com

શ્રી ગંગાજીની આરતી

ૐ જય ગંગે માતા દેવી જય ગંગે માતા,
જો નર તુમકો ધ્યાતા,મનવાંછિત ફલ પાતા ------ૐ

ચંદ્રસિ જ્યોત તુમ્હારી,જલ નિર્મલ આતા
શરણ પડે જો તેરી, સો નર તર જાતા ------- ૐ

પુત્ર સગર કે તારે, સબ જગકો જ્ઞાતા
કૃપા દ્રષ્ટિ તુમ્હારી, ત્રિભુવન સુખ દાતા---------- ૐ

એક હી બાર જો તેરી,શરણાગતી આતા
યમકી ત્રાસ મિટાકર પરમ ગતિ પાતા --------- ૐ

આરતી માત તુમ્હારી જો જન નિત ગાતા
'અર્જુન' વહી સહજમેં, મુક્તિ કો પાતા -------- ૐ

☆☆☆☆☆☆☆

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n53/mode/1up

realpatidar.com

બોલો શ્રી દ્વારિકાનાથ કી જય
સદ્‌ગુરૂ દેવ કી જય
લક્ષ્મી નારાયણ ભગવાન કી જય
શ્રી રામચંદ્ર ભગવાન કી જય
કૃષ્ણ કનૈયાલાલ કી જય
ઉમિયા માત કી જય
હિંગલાજ માત કી જય
અંબે માત કી જય
યોગેશ્વર ભગવાન કી જય
સનાતન ધર્મ કી જય
ગૌ માતા કી જય, ગૌ માતા કી જય
ગૌ માતા કી જય
ૐ નમો પાર્વતિ પતયે હર હર મહાદેવ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n54/mode/1up

realpatidar.com

શ્રી ગુરૂ દેવા સાહેબ શ્રી ગુરૂ હરસુખસ્વામી હમલા - કચ્છના સંત - મહંતો

હમલા આશ્રમ

સંતશ્રી દેવાસાહેબ શ્રી ગુરૂ હરસુખ સ્વામીના શિષ્યરત્નો ચાર

(૧) શ્રી જેઠીરામ મહારાજ નાગ્રેચા કોટડી - કચ્છ આશ્રમ
(૨) શ્રી વિહારીસાહેબ મહારાજ વાંઢાય - કચ્છ ઈશ્વર આશ્રમ
(૩) શ્રી સેવાદાસજી મહારાજ સિંધ (પાકિસ્તાન) આશ્રમ
(૪) શ્રી કરસનદાસજી મહારાજ હમલા (સ્થાનિકે) આશ્રમ

શ્રી વિહારીસાહેબ મહારાજશ્રી વાંઢાયમાં આશ્રમ સ્થાપી ભજન કર્યું. તેમના શિષ્યરત્નશ્રી ક્ષેમસાગર સાહેબ.

શ્રી ક્ષેમસાગર સાહેબે ભીમપર તા. અબડાસા -કચ્છમાં આશ્રમ સ્થાપી ભજન કર્યું. વર્તમાન ગાદીપતિ મહંતશ્રી શંભુદાસજી બિરાજમાન છે.

શ્રી ક્ષેમસાગર સાહેબના શિષ્યરત્નશ્રી ઈશ્વરરામજી મહારાજ જેમણે વાંઢાયમાં જ રહીને ભજન કર્યું.

શ્રી ઈશ્વરરામજી મહારાજશ્રીના શિષ્યરત્નો - બે

(૧) સંત શ્રી ગરીબદાસજી મહારાજ - કુકમા નિવૃતિ - આશ્રમ
(૨) સંત શ્રી લાલરામજી મહારાજ - વાંઢાય - ઈશ્વર આશ્રમ

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n55/mode/1up

realpatidar.com

નિવૃત્તિ આશ્રમ

સંત શ્રી ગરીબદાસજી શ્રી ગુરૂ ઈશ્વરરામજી મહારાજના શિષ્યરત્ન શ્રી સાધુ ભાણદાસજી - નિવૃત્તિ આશ્રમ. (વર્તમાન ગાદીપતિ)

સાધુ શ્રી ભાણદાસજી મહારાજના શિષ્યરત્ન સાધુ શ્રી વાસુદેવદાસજી મહારાજ (વર્તમાન)નિવૃત્તિ - આશ્રમ કુકમામાં રહી ભજન કરે છે

ઈશ્વર આશ્રમ વાંઢાય

સંત શ્રી લાલરામજી મહારાજશ્રી શિષ્યરત્ન - એક

સંત શ્રી ઓધવરામજી મહારાજ.

સંતશ્રી ઓધવરામજી મહારાજશ્રીના શિષ્યરત્ન

સંત શ્રી દયાળદાસજી મહારાજ

સંત શ્રી દયાળદાસજી મહારાજના શિષ્યરત્નો - બે

(૧) શ્રી શાંતીદાસજી મહારાજ

(૨) શ્રી સેવાદાસજી મહારાજ (વર્તમાન)

સંત શ્રી શાંતીદાસજી મહારાજના શિષ્યરત્ન

શ્રી કરસનદાસજી મહારાજ (વર્તમાન ગાદીપતિ)

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

ઈશ્વર આશ્રમ, વાંઢાયની સંત પરંપરા

પ.પૂ. શ્રી વિહારી સાહેબ ગુરુ શ્રી દેવા સાહેબ - વાંઢાય.

જન્મ : વિ. સંવત ૧૮૦૪

પ.પૂ. શ્રી ક્ષેમસાગરજી મહારાજ

જન્મ : શ્રાવણ સુદ ૧૪, સંવત ૧૮૪૦ મંજલ (નખત્રાણા)

નિર્વાણ : મહા સુદ ૧૩, સંવત ૧૯૨૮

પ.પૂ. શ્રી ઈશ્વરરામજી ગુરુ શ્રી ક્ષેમસાગર

જન્મ : ચૈત્ર સુદ ૯

નિર્વાણ : અષાઢ વદ, ૨ સંવત ૧૯૫૩

પ.પૂ. શ્રી લાલરામજી ગુરુ શ્રી ઈશ્વરરામજી

જન્મ : વૈશાખ સુદ ૨, સંવત ૧૯૧૩

નિર્વાણ : મહા વદ ૨, સંવત ૧૯૭૧

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n57/mode/1up

realpatidar.com

પ.પૂ. શ્રી ઓધવરામજી ગુરુ શ્રી લાલરામજી

જન્મ : ચૈત્ર સુદ ૯, સંવત ૧૯૪૫

નિર્વાણ : પોષ સુદ ૧૩, સંવત ૨૦૧૩

પ.પૂ. શ્રી દયારામજી ગુરુ શ્રી ઓધવરામજી

જન્મ : આસો સુદ ૧૫, સંવત ૧૯૫૧

નિર્વાણ : આસો સુદ ૩, સંવત ૨૦૧૯

પ.પૂ. શ્રી શાંતીરામજી ગુરુ શ્રી દયારામજી

જન્મ : સંવત ૧૯૮૩

નિર્વાણ : કારતક વદ ૧, સંવત ૨૦૩૬

આઠમી ગાદી

ઈશ્વર આશ્રમના વિદ્યમાન મહંત

પ.પૂ. શ્રી કરસનદાસજી ગુરુ શ્રી શાંતીરામજી

જન્મ : વૈશાખ સુદ ૩, ગુરુવાર સંવત ૧૯૯૭

ॐ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1095/page/n58/mode/1up

realpatidar.com

ઉમીયાજીની આરતી

જય ઉમીયા માતા ૐ જય ઉમીયા માતા
જય ગિરીરાજ કિશોરી (૨) સર્વે સુખદાતા ॥ ઓમ
જગદમ્બા જગજનની આદીશક્તિ માતા મા
સકલ શાસ્ત્ર ઉમીયા મા (૨) ગુણ તારા ગાતા ॥ ઓમ
પરમ ઉદાર દયાળુ સુંદર છબી તારી મા
ઉંઝાની મહારાણી (૨) શીવજીને પ્યારી ॥ ઓમ
શ્રી ગણેશને કાર્તિક તમ સાથે શોભે મા
દર્શન કરતાં માના (૨) જનજન મન મોહે ॥ ઓમ
વાંઢાય ગામ પધારી દર્શન બહુ દીધાં મા
રામકુમાર વખાણે (૨) સંકટ હરી લીધાં ॥ ઓમ
મા મન વિરક્ત કીધાં

(રચયિતા : શ્રી રામકુમારદાસજી ખાખી બાપુ)

realpatidar.com

https://archive.org/details/bk1095/page/n59/mode/1up

realpatidar.com

ગુરુજીના નામની માળા

ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
નારાયણ નામની હો માળા છે ડોકમાં...ટેક

(૧) જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં,
અવળું ચલાય નહીં, હો, માળા છે ડોકમાં....ગુરુજીના

(૨) ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં,
કોઈને દૂભાવાય નહીં, હો, માળા છે ડોકમાં...ગુરુજીના

(૩) પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં,
પાપને પોષાય નહીં, હો માળા છે ડોકમાં...ગુરુજીના

(૪) સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં,
ભક્તિ ભૂલાય નહીં, હો, માળા છે ડોકમાં...ગુરુજીના

(૫) ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં,
ભેદ રખાય નહીં, હો માળા છે ડોકમાં...ગુરુજીના

(૬) બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં,
બહાનું લજવાય નહીં, હો, માળા છે ડોકમાં...ગુરુજીના

(૭) હરીહરાનંદજી કહે, સત્ય મુકાય નહીં,
ગુરુજી વીસરાય નહીં, હો, માળા છે ડોકમાં...ગુરુજીના

ડાયલ પ્રિન્ટરી - ભુજ ફોન : ૨૩૯૨૪

realpatidar.com